

*** ધોરણ: 12 વિષય: નામાનાં મૂળતત્વો (154) ***

ક્રમ	પ્રકરણ	અભ્યાસક્રમમાં રાખેલા પ્રકરણ/મુદ્દાઓ	અભ્યાસક્રમમાંથી ચાલુ વર્ષ માટે બાદ કરેલ પ્રકરણ/મુદ્દાઓ	રીમાર્ક્સ
ભાગ 1 1	ભાગીદારી વિષય: પ્રવેશ	1. પ્રસ્તાવના 2. ભાગીદારીનો અર્થ અને વ્યાખ્યા 3. ભાગીદારીનાં લક્ષણો 4. ભાગીદારી કરારનામું (ખતપત્ર) 5. ભાગીદારી કરારનામા (ખતપત્ર) ની ગેરહાજરીમાં હિસાબોને અસર કરતી ભારતીય ભાગીદારી કાયદા 1932ની જોગવાઈઓ 6. ભાગીદારોનાં મૂડી ખાતાં 7. સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અને અસ્થિર મૂડી ખાતાંની પદ્ધતિ વચ્ચેનો તફાવત 8. ભાગીદારોનાં ઉપાડ ખાતાં 9. નફા – નુકસાન ફાળવણી ખાતું 11. વિશિષ્ટ ઉદાહરણો- સ્વાધ્યાય	મુદ્દા નં 11 માં ઉદા નં 14 થી 16 સ્વા દા નં. 10 થી 12	-
2	ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો	સંપૂર્ણ પ્રકરણ રાખેલ છે.	-	-
3	પાઘડીનું મૂલ્યાંકન	સંપૂર્ણ પ્રકરણ રાખેલ છે.	-	-
4	ભાગીદારીનું પુનર્ગઠન	1. પ્રસ્તાવના 2. ચાલુ ભાગીદારો વચ્ચે નફા – નુકસાનની ફાળવણી કે વહેંચણીના પ્રમાણમાં ફેરફાર 3. ભાગીદારી પેઢીની મિલકતો અને દેવાંનું (જવાબદારીનું) પુનઃમૂલ્યાંકન અને તેની હિસાબી અસરો 4. ભાગીદારો વચ્ચે અનામત અને એકત્રિત નફાની વહેંચણી 5. પાઘડી- સ્વાધ્યાય	ઉદા નં 12 અને સ્વા. દા. નં 14	-

5	ભાગીદારનો પ્રવેશ	1. પ્રસ્તાવના 2. નવા ભાગીદારના પ્રવેશની અસર 3. નફા – નુકસાનની વહેંચણીના પ્રમાણમાં ફેરફાર 4. પાઘડીની હિસાબી અસરો હિસાબી ધોરણ 26 પ્રમાણે 5. મિલકતોના પુનઃમૂલ્યાંકન અને દેવાંની પુનઃઆકારણીની હિસાબી અસરો 6. અનામતો અને એકત્રિત નફા – નુકસાનની વહેંચણી (નોંધો) 7. મૂડી ખાતામાં ફેરફાર અને નવા પાકા સરવૈયાની રચના 8. ઉદાહરણો - સ્વાધ્યાય	મુદ્દા નં 7 માં મૂડીખાતામાં થતા ફેરફારને લગતા દાખલા જેમાં ઉદા. નં 26 થી 30 સ્વા. ના દા.નં 15 થી 20	-
6	ભાગીદારની નિવૃત્તિ / મૃત્યુ	1. પ્રસ્તાવના 2. ભાગીદારની નિવૃત્તિના સંજોગો 3. મહત્વની હિસાબી બાબતો અને હિસાબી અસરો 4. નફા – નુકસાનના નવા પ્રમાણની અને લાભના પ્રમાણની ગણતરી 5. પાઘડીની હિસાબી અસરો 6. મિલકતો અને દેવાંનું પુનઃમૂલ્યાંકન 7. અનામતો અને નહિ વહેંચાયેલ નફા – નુકસાનની વહેંચણી 8. નિવૃત્ત થતા ભાગીદારને ચૂકવવાપાત્ર રકમ નક્કી કરવી - સ્વાધ્યાય	9. મૃત્યુ પામનાર ભાગીદારને ચૂકવવાપાત્ર રકમ નક્કી કરવી અને તેના વહીવટકર્તાને ચૂકવણી કરવી. ઉદા. નં 24 થી 27 સ્વા. માં દા. નં. 16 થી 19	-
7	ભાગીદારી પેઢીનું વિસર્જન	1. પ્રસ્તાવના 2. વિસર્જનનો અર્થ 3. “પેઢી” અને “ભાગીદારી” નું વિસર્જન 4. ભાગીદારી પેઢીનું વિસર્જન 5. વિસર્જનની હિસાબી અસરો – સ્વાધ્યાય	આ પ્રકરણના મોટા દાખલા અને ખૂટતી વિગતો શોધવી ઉદા. નં 2 થી 9, સ્વા. માં દા. નં. 7 થી 10 (સામાન્ય રીતે આ પ્રકરણમાંથી મોટા દાખલા પૂછવામાં આવતા નથી.)	-

ભાગ 2 1	શેરમૂડીના હિસાબો	1. પ્રસ્તાવના 3. શેર અને શેરમૂડી: અર્થ, સ્વરૂપ અને પ્રકારો 4. ઈક્વિટી શેર બહાર પાડવા અંગેના તબક્કા 5. શેરનું અતિ ભરણું અને ઓછું ભરણું 6. આઈ.પી.ઓ અને એફ.પી.ઓ 7. કંપની દ્વારા શેર બહાર પાડવા અંગેની રીતો 8. શેરમૂડીને લગતા વ્યવહારો અને તેની હિસાબી અસરો 9. મળવાના બાકી હપતા 11. શેર પ્રીમિયમે બહાર પાડવા અંગે 12. શેર જપ્તી 13. જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવા અંગે- સ્વાધ્યાય	2. કંપનીના પ્રકારો 3. જેમાં પ્રેફરન્સ શેરના પ્રકારો રદ કરવા 10. અગાઉથી મળેલ હપતા ઉદા નં. 5, 6, 8, 13, સ્વા દા. નં 8 અને 11 14. શેરની પ્રમાણસર ફાળવણી 15. રોકડ સિવાયના અવેજથી શેર બહાર પાડવા અંગે 16. કંપનીના ઊભા પાકા સરવૈયામાં શેરમૂડીનું પ્રગટીકરણ 17. કેટલીક વિશિષ્ટ બાબતો ઉદા. નં 15 થી 19 સ્વા.માં દા. નં. 19 થી 24	
2	ડિબેન્ચરના હિસાબો	1. પ્રસ્તાવના 2. ડિબેન્ચર અંગે અગત્યના મુદ્દા 5. ડિબેન્ચર બહાર પાડવા અંગેની હિસાબી અસરો 9. ડિબેન્ચરનાં નાણાં પરત કરવા અંગે 10. પરત કરી શકાય તેવા ડિબેન્ચર બહાર પાડતી વખતે તેની હિસાબી અસરો. - સ્વાધ્યાય	3. ડિબેન્ચરના પ્રકારો 4. ડિબેન્ચર બહાર પાડવા અંગેની વિધિ 6. રોકડ સિવાયના અવેજથી ડિબેન્ચર બહાર પાડવા 7. આનુષંગિક જામીનગીરી તરીકે બહાર પાડેલા ડિબેન્ચર 8. ડિબેન્ચર પર વ્યાજ 11. ડિબેન્ચર પરત કરવા માટે નાણાંની જોગવાઈ 12. ડિબેન્ચર પરત કરવાની રીતો 13. શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત મુદ્દા નં. 5 માં ઉદા નં 5 થી 7 તથા ઉદા નં. 8 થી 11 અને ઉદા નં. 18 થી 24 સ્વા. માં. દા. નં. 11 થી 14 અને 19 થી 29	

3	કંપનીના વાર્ષિક હિસાબો	સંપૂર્ણ પ્રકરણ રાખેલ છે.	-	-
4	નાણાકીય પત્રકોનું વિશ્લેષણ	1. પ્રસ્તાવના 2. નાણાકીય પત્રકોનો અર્થ 5. નાણાકીય વિશ્લેષણનો અર્થ 6. નાણાકીય વિશ્લેષણના પ્રકારો 13. નાણાકીય પત્રકોના વિશ્લેષણનાં સાધનો 14. તુલનાત્મક પત્રકો - સ્વાધ્યાય	3. નાણાકીય પત્રકોના ઉદ્દેશો અને પ્રકારો 4. નાણાકીય પત્રકોનું મહત્વ 7. નાણાકીય વિશ્લેષણના હેતુઓ 8. નાણાકીય વિશ્લેષણના ઉપયોગો 9. નાણાકીય વિશ્લેષણના ઉપયોગકર્તાઓ 10. નાણાકીય પત્રકોના વિશ્લેષણની મર્યાદાઓ 11. તુલનાત્મક નાણાકીય પત્રકોનું મહત્વ 12. નાણાકીય પત્રકોના વિશ્લેષણના તબક્કાઓ મુદ્દા નં. 14 માં ખૂટતી વિગતો શોધવાના દાખલા 15. સમાન માપના પત્રકો ઉદા નં. 9 થી 12, સ્વા માં દા નં. 8 અને 10 ઉદા નં. 13 થી 20, સ્વા માં દા નં 11 થી 14 મુદ્દા નં 15 માં ખૂટતી વિગતો શોધવાના દાખલા ઉદા નં. 17 થી 20 સ્વા. દા નં. માં 12 અને 14	-
5	હિસાબી ગુણોત્તરો અને વિશ્લેષણ	1. પ્રસ્તાવના 5. ગુણોત્તરની રજૂઆત 6. ગુણોત્તરોનું વર્ગીકરણ 7. નફાકારકતાના ગુણોત્તરો 8. તરલતાના ગુણોત્તરો 10. કાર્યક્ષમતાના ગુણોત્તરો - સ્વાધ્યાય	2. ગુણોત્તરોની વિશેષતા 3. ગુણોત્તર વિશ્લેષણના હેતુઓ 4. ગુણોત્તર વિશ્લેષણની મર્યાદાઓ 7. માં કામગીરી ગુણોત્તર અને કામગીરી નફાનો ગુણોત્તર ઉદા નં 6 થી 9 અને સ્વા.મા દા નં. 5 અને 6 9. સધ્ધરતાના ગુણોત્તરો ઉદા. નં. 16 થી 22 સ્વા. માં દા. નં 9 થી 14	

6	રોકડ પ્રવાહ પત્રક	1. પ્રસ્તાવના 2. પારિભાષિક શબ્દોનો અર્થ 3. રોકડપ્રવાહની પ્રવૃત્તિઓનું વર્ગીકરણ 4. વિશિષ્ટ પ્રવૃત્તિઓ 5. રોકડ પ્રવાહ પત્રક 7. રોકાણની પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ - સ્વાધ્યાય	6. કામગીરી પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ ઉદા નં 5, 6, 7, 8, 9, 10, 15, 16 સ્વા દા નં 15, 16, 17 8. નાણાકીય પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ ઉદા નં 14 સ્વા દા નં 20 અને 21	-
---	-------------------	--	--	---